



GUJARAT TECHNOLOGICAL UNIVERSITY

(Established by Government of Gujarat under Gujarat Act No.: 20 of 2007)

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી

(ગુજરાત સરકારના ગુજરાત અધિનિયમ ક્રમાંક : ૨૦/૨૦૦૭ દ્વારા સ્થાપિત)

Ref: GTU/MissionSahasi/2019/8732

Date: 11/09/2019

“મિશન સાહસી”

“મિશન સાહસી” કાર્યક્રમનું આયોજન જી.ટી.યુ. અને વિદ્યાર્થી વિકાસ નિધિ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવેલ છે. જેનો ઉદ્દેશ મહિલાઓમાં આત્મવિશ્વાસ ઉભો કરવો એટલું જ નહીં પરંતુ સમાજમાં પ્રવર્તી રહેલા “ચલતા હૈ ...” વલણમાં પણ જરૂરી પરિવર્તન લાવવાનો છે. મિશન સાહસી એ 13 થી 25 વર્ષની વય જૂથની મહિલાઓ માટે આત્મ-સંરક્ષણ તાલીમ ની સાથે આરોગ્ય, સલામતી અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિનો કાર્યક્રમ છે. મિશન સાહસી ખાસ કરીને વર્તમાન સમયે મહિલાઓને રોજિંદા જીવનમાં આવતા પડકારો જેમકે વેરાન માર્ગો પર અથવા ખાલી ટ્રેનમાં મુસાફરી કરી રહી હોય, જાણીતા અથવા અજાણ્યા લોકોની સંગતમાં હોય ત્યારે ધાકધમકી, છેડતી અને કટોકટીના સમયે પોતાનો બચાવ કરી શકે એ હેતુથી કરવામાં આવેલ પહેલ છે. મિશન સાહસીમાં આપવામાં આવનાર આત્મરક્ષણની તાલીમનું માળખું માર્શલ આર્ટના નિષ્ણાત ટ્રેનર્સ દ્વારા બનાવવામાં આવેલ છે.

કાર્યક્રમ ના ઉદ્દેશ:-

- બહેનોને આત્મરક્ષણની તાલીમ આપવી.
- મહિલા-આરોગ્ય અંગેની જાગૃતિ લાવવી.
- સલામતીના મુદ્દાઓ વિશે જાગૃતિ લાવવી .
- બહેનોમાં આત્મવિશ્વાસ વધારવો .
- મહિલાઓમાં નવું નેતૃત્વ ઉભું કરવું.

જી.ટી.યુ. અંતર્ગત માત્ર અમદાવાદ ઝોનમાં આવેલ કોલેજોને આ કાર્યક્રમમાં નીચે મુજબના તબક્કા દરમ્યાન ભાગ લેવા માટે જણાવવામાં આવે છે. દરેક સંસ્થામાં 3 દિવસ તાલીમ આપવામાં આવશે, જેમાં પ્રતિ દિવસ સંસ્થા / વિદ્યાર્થીની ની અનુકૂળતાએ એક કલાક તાલીમ આપવામાં આવશે. સંસ્થાએ પોતાની અનુકૂળતા મુજબ નીચે દર્શાવેલ તબક્કાઓ માંથી એક તબક્કો પસંદ કરવાનો રહેશે.

- તબક્કો 1 :- 12,13,14 સપ્ટેમ્બર, 2019
- તબક્કો 2 :-16,17,18 સપ્ટેમ્બર, 2019
- તબક્કો 3 :-19,20,21 સપ્ટેમ્બર, 2019
- તબક્કો 4 :-24,25,26 સપ્ટેમ્બર, 2019

તાલીમ ના બધા તબક્કાઓ પૂર્ણ થયે, તા. - 28/09/19 ના રોજ મેગા ડેમોન્સ્ટ્રેશનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

Winners of : ICT Enabled University Award E-India - 2009 ❖ Manthan Award - 2009 ❖ GESIA Award - 2011
❖ Digital Learning WES - 2011 Award ❖ AIMS International Innovative University Award - 2013

Chandkheda : Nr. Campus of Vishwakarma Government Engineering College, Sabarmati - Koba Highway, Nr. Visat Three Roads, Chandkheda, Ahmedabad - 382 424. Gujarat, India Ph. : 079 - 232 67 500 Fax : +91 - 79 232 67 580
Ahmedabad : 2nd Floor, ACPC Building, L. D. College of Engineering Campus, Navrangpura, Ahmedabad, (Gujarat) India - 380 015. Phone : + 91 - 79 - 26 300 499 / 599 Fax : + 91 - 79 - 26 30 1500
Gandhinagar : K-6 Circle, E-4 Electronic Estate G.I.D.C., Nr. Government Polytechnic, Sector-26, Gandhinagar - 382 028 Gujarat. e-mail : info@gtu.ac.in URL : www.gtu.ac.in



GUJARAT TECHNOLOGICAL UNIVERSITY

(Established by Government of Gujarat under Gujarat Act No.: 20 of 2007)

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી

(ગુજરાત સરકારના ગુજરાત અધિનિયમ ક્રમાંક : ૨૦/૨૦૦૭ દ્વારા સ્થાપિત)

- જે વિદ્યાર્થીની ઓ સંસ્થા ખાતે તાલીમ લેશે અને ત્યારબાદ મેગા ડેમોન્સ્ટ્રેશન માં પણ ભાગ લેશે, તેને જી.ટી.યુ. તરફ થી સર્ટિફિકેટ આપવામાં આવશે અને આ સર્ટિફિકેટ માટે જે તે વિદ્યાર્થીની ને 100 Activity Points માં પોઈન્ટ્સ પણ પ્રાપ્ત થશે.
- દરેક કોલેજને જણાવવામાં આવે છે કે, આ કાર્યક્રમ માટે આપની કોલેજ માંથી ૧૦ વોલેન્ટિયર તથા ૧ મહિલા પ્રાધ્યાપકની ઇન્ચાર્જ તરીકે નિમણુક કરવી.
- વધુ માહિતી માટે (M) 97237 46434 અને E-mail ID – missionsahasiguj@gmail.com ઉપર સંપર્ક કરવો.



Sd/-
(રજિસ્ટ્રાર)

Winners of : ICT Enabled University Award E-India - 2009 ❖ Manthan Award - 2009 ❖ GESIA Award - 2011
❖ Digital Learning WES - 2011 Award ❖ AIMS International Innovative University Award - 2013

Chandkheda : Nr. Campus of Vishwakarma Government Engineering College, Sabarmati - Koba Highway, Nr. Visat Three Roads, Chandkheda, Ahmedabad - 382 424. Gujarat, India Ph. : 079 - 232 67 500 Fax : +91 - 79 232 67 580
Ahmedabad : 2nd Floor, ACPC Building, L. D. College of Engineering Campus, Navrangpura, Ahmedabad, (Gujarat) India - 380 015. Phone : + 91 - 79 - 26 300 499 / 599 Fax : + 91 - 79 - 26 30 1500
Gandhinagar : K-6 Circle, E-4 Electronic Estate G.I.D.C., Nr. Government Polytechnic, Sector-26, Gandhinagar - 382 028 Gujarat. e-mail : info@gtu.ac.in URL : www.gtu.ac.in